

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

(કૃ. ગોવિંદ રઘુનાથ દાલોળકર ઉદ્દેશ્યે હેમાટપંતનું  
શ્રી સાઈ કાર્યાલિયા ઉપરનું ગધભાજી - આલોચના)

મરાઠી લેખક :

રવ. લે. કર્ણલ મુ. બ. નિંબાળકર

ગુજરાતી અનુવાદ :

પ્રો. દિનેશ પાઠક

સંપાદક :

જયસ્થિંધ બ. નિંબાળકર

પ્રકાશક :

કિશોર મોરે

(કાર્યકારી અધિકારી)

શ્રી સાઈબાબા સંક્ષાન વિશ્વક્રત વ્યવસ્થા, શિારડી

---

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

---

### -: ગ્રંથપ્રાપ્તિ સ્થાન :-

#### શ્રી સાઈબાબા સંસ્થાન વિશ્વસ્ત વ્યવસ્થા, શિરડી

પો. શિરડી - ४२३१०८,  
તા. રાહુતા, જિ. અહમદનગર, મહારાષ્ટ્ર રાજ્ય.  
ફોન નં. : ૦૨૪૨૩ - ૨૫૮૫૦૦  
ફેક્સ : ૦૨૪૨૩ - ૨૬૮૭૭૦  
ઈ-મેલ : saibaba@sai.org.in  
ઇન્ટરનેટ વેબસાઈટ : URL:<http://www.sai.org.in>

#### મુંબઈ કાર્યાલય :

'સાઈનિકેન', ૮૦૪-બી, ડૉ. આંબેડકર માર્ગ,  
દાદર, મુંબઈ - ૪૦૦૦૧૪.  
ફોન નં. : ૦૨૨ - ૨૪૧૬૬૫૫૬, ૨૪૧૬૧૨૬૩  
ફેક્સ : ૦૨૨ - ૨૪૧૫૦૧૬૮  
ઈ-મેલ : saidadar@sai.org.in

### -: ૦ બદા અધિકાર પ્રકાશકને આધિન :-

#### મુખ્યપૃષ્ઠ અને સાચાવટ :

જયસિંહ નિંબાળકર

આવૃત્તિ : Second (2014)

તકા : 1000

#### ટાઈપ સોટિગ :

વિશાળ ઓફિસેટ  
સી/૧, સરદાર એસ્ટેટ, આંજવા રોડ,  
વડોદરા-૩૬૦૦૧૮. ફોન : ૦૨૬૫ - ૨૫૬૦૧૬૪

કિંમત રૂ. : 219.00

મુદ્રક : Sakal Papers Ltd., Kolhapur

---

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

---

### અનુકૂળણિકા।

પ્રથમ મરાઠી આવૃત્તિની પ્રસ્તાવના  
સંપાદકીય  
લેખકના બે શબ્દો  
અનુવાદકના બે શબ્દો  
શ્રી સાઈની ભક્તિ શા માટે કરવી એનાં ૧૧ કારણો  
શ્રી સાઈ સત્ય ચારિત્ર કેવી રીતે વાંચવું ?  
શ્રી સાઈ સત્ય ચારિત્રની ફળશ્રુતિ  
લે. કર્ણલ સ્વ. મુ. બ. નિંબાળકરનો. પરિચય (કવર પેજ)  
શ્રી સાઈનું સત્ય ચારિત્ર

અધ્યાય ૧	મંગલાચરણ	૧-૮
અધ્યાય ૨	કથા પ્રયોજન - નામકરણ	૯-૧૮
અધ્યાય ૩	ગ્રંથ પ્રયોજન - અનુષ્ઠાપન	૧૯-૨૯
અધ્યાય ૪	સાઈસમર્થ અવતરણ	૩૦-૪૧
અધ્યાય ૫	શ્રી સાઈનું ફરી પ્રગાઠ થવું	૪૨-૫૦
અધ્યાય ૬	રામજન્મ ઉત્સવ આહિની કથા	૫૧-૫૮
અધ્યાય ૭	વિવિધ કથાઓનું નિદ્રપણ	૫૯-૬૫
અધ્યાય ૮	નરજન્મ મહિમા, બિક્ષા અન્નસેવન, બાયજલબાઈનું ભક્તિવર્ણન તથા તાત્યા અને મહાળસાપત્તિનું મસ્તિષ્ઠમાં સૂર્ય જવું	૬૬-૭૩
અધ્યાય ૯	આજા-અવજા વિઘ્નો, બિક્ષાવૃત્તિથી પંચ પાતકોનો નાશ તથા ભક્ત તર્ફની કથા	૭૪-૮૪
અધ્યાય ૧૦	શ્રી સાઈ સમર્થ મહિમા	૮૫-૯૩
અધ્યાય ૧૧	શ્રી સાઈ મહિમા વર્ણન	૯૪-૧૦૪
અધ્યાય ૧૨	શ્રી સંત ધોલપ - રામ દર્શન	૧૦૫-૧૧૩
અધ્યાય ૧૩	ભીમાળનું ક્ષયરોગનું નિવારણ	૧૧૪-૧૨૪
અધ્યાય ૧૪	રતનજી - સાઈ સમાગમ	૧૨૫-૧૩૫
અધ્યાય ૧૫	ચોલકરનું શર્કરાનું આખ્યાન	૧૩૬-૧૪૨
અધ્યાય ૧૬	બ્રહ્મજાનનું કથન - ૧	૧૪૩-૧૫૨
અધ્યાય ૧૭	બ્રહ્મજાનનું કથન - ૨	૧૫૩-૧૬૭
અધ્યાય ૧૮	મદ + અનુગ્રહ - ૧	૧૬૮-૧૭૫
અધ્યાય ૧૯	મદ + અનુગ્રહ - ૨	૧૭૬-૧૮૬
અધ્યાય ૨૦	ઠિશાવાસ્ય - ભાવાર્થ બોધ	૧૮૦-૧૮૮
અધ્યાય ૨૧	અનુગ્રહ - કરણ	૧૯૯-૨૦૪

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

---

અધ્યાય ૨૨	અપમૃત્યુ - નિવારણ	૨૦૫-૨૧૬
અધ્યાય ૨૩	ગુરુ - ભક્ત લીલા - દર્શન	૨૧૭-૨૨૮
અધ્યાય ૨૪	વિનોદ વિલાસ વૃત્તિ	૨૨૯-૨૩૭
અધ્યાય ૨૫	ભક્તોની ઈચ્છિત ફળ પ્રાપ્તિ અને કલ્યાણ	૨૩૮-૨૪૫
અધ્યાય ૨૬	તાણની બીમારી - આત્મહત્યા નિવારણ તથા પોતાના ગુરુપદ સ્થિરીકરણ	૨૪૬-૨૫૪
અધ્યાય ૨૭	દ્રિક્ષા - અનુગ્રહ અને દાન	૨૫૫-૨૬૭
અધ્યાય ૨૮	દૃષ્ટાંતનું કથન	૨૬૮-૨૭૯
અધ્યાય ૨૯	સ્વખા - કથા - કથન	૨૮૦-૨૮૮
અધ્યાય ૩૦	બાધાઓ વગેરેનું કથન	૨૮૯-૨૯૬
અધ્યાય ૩૧	દર્શન - મહિમા	૨૯૭-૩૦૭
અધ્યાય ૩૨	ગુરુ - મહિમા - વર્ણન	૩૦૮-૩૧૬
અધ્યાય ૩૩	ઉદ્દી - પ્રભાવ	૩૧૭-૩૨૬
અધ્યાય ૩૪	ઉદ્દી - મહિમા	૩૩૦-૩૩૮
અધ્યાય ૩૫	શંકા - કુશંકા નિવારણ અને ઉદ્દીનું માહિત્ય	૩૩૯-૩૪૨
અધ્યાય ૩૬	સાઈની સર્વ વ્યાપકતા તેમજ આશીર્વાદોની સફળતા	૩૪૩-૩૬૦
અધ્યાય ૩૭	ચાવડીનું વર્ણન	૩૬૧-૩૭૫
અધ્યાય ૩૮	હુંડીનું વર્ણન	૩૭૬-૩૮૮
અધ્યાય ૩૯	ગીતાના શ્લોકનું અર્થઘટન તથા સમાધિમંહિરનું નિર્મણ	૩૮૯-૪૦૦
અધ્યાય ૪૦	વ્રતોની સમાપ્તિ પર કરાવનારી વિધિઓના પ્રસંગ અને એને લગતા પ્રસંગોનું વર્ણન	૪૦૧-૪૦૮
અધ્યાય ૪૧	સાઈ - કૃપા - અનુગ્રહ - દાન	૪૦૯-૪૧૭
અધ્યાય ૪૨	શ્રી સાઈનાથનું નિર્વાણ - ૧	૪૧૮-૪૨૬
અધ્યાય ૪૩	શ્રી સાઈનાથનું નિર્વાણ - ૨	૪૨૭-૪૩૯
અધ્યાય ૪૪	શ્રી સાઈનાથનું નિર્વાણ - ૩	૪૪૦-૪૫૦
અધ્યાય ૪૫	ગુરુચરણનો મહિમા	૪૫૧-૪૫૮
અધ્યાય ૪૬	કાશી, ગયા - ગમન અને પૂર્વજન્મની કથા કહેવી	૪૫૮-૪૬૪
અધ્યાય ૪૭	શ્રી સાઈબાબાના મોઢેથી સાંભળેલી કથાઓનું વર્ણન	૪૬૪-૪૭૬
અધ્યાય ૪૮	શંકાખોર ભક્તો ઉપર કૃપા કરવી	૪૭૭-૪૮૫
અધ્યાય ૪૯	સંત પરીક્ષણ અને મનને તાબામાં રાખવું	૪૮૬-૪૯૬
અધ્યાય ૫૦	અજ્ઞાન, માયા અને ભ્રમનો નાશ અથવા નિવારણ	૪૯૭-૫૧૦
અધ્યાય ૫૧	ત્રણ ભક્તોની કથા કહેવી	૫૧૧-૫૨૩
અધ્યાય ૫૨	શ્રી સદગુરુ માહિત્ય, શ્રી સાઈ સત્ય ચરિત્રની ફળશુદ્ધિ તથા ગ્રંથકારની પ્રસાદ યાચના	૫૨૪-૫૨૯
અધ્યાય ૫૩	ગ્રંથના અંતમાં આપેલો અધ્યાયો પરનો સારાંશ	૫૩૦-૫૪૪
(ક)	હેમાદ્રિપંતનું કવિત્વ	૫૪૫-૫૪૯

## પ્રથમ મરાಠી આવૃત્તિની પ્રસ્તાવના

આ ચિત્રના નથી, સુખનો છે ટેવો. (સંગ્રહ) | સ્વ પરમ અમૃતનો મેવો |

જેના હોય ભાગ્યમાં એને થશે પ્રાપ્ત | ભક્તિ લાવના થશે એનાં આપ્ત ||

જેમ ભગવાન કૃષ્ણાની ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ અને જ્ઞાનેશ્વરી જેમ સંત શિરોમણી જ્ઞાનેશ્વરની વાડમય મૂર્તિ છે, એવી રીતે જ હેમાડપંતનું ‘શ્રી સાઈસચ્ચરિત્ર’ એ શ્રી સાઈબાબાની વાડમય મૂર્તિ છે. એવું આ પરમભંગલ ‘શ્રી સાઈસચ્ચરિત્ર’ પોથીનો સાઈભક્ત કે. મુ. બ. નિંબાળકરલુએ કરેલા ગધ-ભાજ્ય-અનુવાદ શ્રી સાઈનું સત્યચિત્રના નામથી પ્રસિદ્ધ થયેલું છે. એવા આ પ્રસિદ્ધ સાઈગ્રંથને શ્રી સાઈબાબા સંસ્થાન, શિરડી દ્વારા પ્રકાશિત નવી સુધારેલી આવૃત્તિનું, સંસ્થાનના અધ્યક્ષ હોવાના નાતે, ભક્તાને અર્પણ કરતાં, હું ગૌરવ અનુભવું છું અને સાઈની કૃપાથી, બહુ વરસથી મનમાં રહી ગયેલું આ કાર્યપૂર્ણ થઈ રહ્યું છે.

કે. મુ. બ. નિંબાળકરની, સાઈભક્તિ, વિદ્વત્તા ભાબતમાં વધારે કહેવાની જરૂરત નથી, સાઈભક્તોમાં એ પરિચિત છે જ. લેખક તરીકે એમનો પરિચય આ ગ્રંથમાં આપેલો છે જ. ૧૯૬૮ થી ૧૯૮૮ના ૨૦ વરસના સમયકાળ દરમ્યાન, હેમાડપંત કૃત શ્રી સાઈસચ્ચરિત્રનું મનન, વાંચન, ચિંતન કરીને આ ગધ-ભાજ્યાનુવાદ કર્યો છે. ટૂંકમાં કહેવા જઈએ તો ગધ-ભાજ્યાનુવાદ ગ્રંથ જાણો કે. નિંબાળકરના આધ્યાત્મિક ચિંતનનું નવનીત છે. એમના ઉપરના સાઈકૃપાનો અક્ષરરદીપ છે એવું મને લાગે છે.

ઈ. સ. ૧૯૬૦-૬૧માં શ્રી નિંબાળકર આ ગધ ગ્રંથને શ્રી સંસ્થાને પ્રસિદ્ધ કરવો એવી એ વખતના વિશ્વસ્ત મંડળને વિનંતી કરી હતી. પણ એવો યોગ આવ્યો નહીં. છેલ્લે બે વરસ રાહ જોઈને એમણે જાતે જ ૧૯૮૮માં પહેલી આવૃત્તિ પ્રસિદ્ધ કરી. ૧૯૮૪માં ધર્માદ્ધાર્ય આયુક્તે શ્રી સાઈબાબા સંસ્થાનના વ્યવસ્થાપન મંડળના અધ્યક્ષપદ માટે મારી નિયુક્તિ કરી. પછી શ્રી નિંબાળકરના ગધગ્રંથનું પ્રકાશન સંસ્થાન તરફથી કરવું. એવો ઠરાવ, વ્યવસ્થાપન મંડળ પાસે આવ્યો. ગ્રંથની એકંદરે યોગ્યતા જણાતાં આવો ગ્રંથ સંસ્થાને પ્રકાશિત કરવો જોઈએ. એવી મારા મનમાં તીવ્ર ઈચ્છા હતી, પણ વ્યવસ્થાપન મંડળમાં એકમત નહીં થતાં, મનમાં હતું છતાંય આ કાર્ય નહીં થયાનો વસવસો રહ્યો.

૧૯૮૮ની સાલમાં મા-ધર્માદ્ધાર્ય આયુક્તો દ્વારા સંસ્થાનમાં અધ્યક્ષપદ માટે મારી ફરીથી નિયુક્તિ કરવામાં આવી. અને સાઈભક્તોની સેવાનો મને ફરીથી લાભ મળ્યો. મેં આવું મનમાં પણ ધાર્યું નહોતુ. ગયા પાંચ વરસમાં તમે જે સાઈભક્તિનું કાર્ય કર્યું, એનું જ આ ફળ છે. એવું ધણાં હિંતચિંતકોએ કહ્યું, આ તો બાબાની જ કૃપા છે અને ૧૯૮૪-૮૮ કાળ સમયમાં જે મનમાં કાર્યો કરવાનાં રહી ગયા હતા, એ હવેના કાળ-સમયમાં પૂરા કરવાનો, મેં મનમાં નિશ્ચય કર્યો.

આ સમય દરમ્યાન શ્રી નિંબાળકરના ગ્રંથની ૧૯૮૮માં બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ ગઈ. ૧૯૮૮માં એમનું આકસ્મિક નિધન થયું. એવામાં બે-ત્રણ વરસ નીકળી ગયા. સુદૈવથી ૨૦૦૩ની સાલમાં કે. મુ. બ. નિંબાળકરના લઘુબંધુ વડોદરાનાં શ્રી જયસિંહ નિંબાળકર તરફથી, આ ગ્રંથના, સંસ્થાન તરફથી પ્રકાશનનો ફરીથી પ્રસ્તાવ આવ્યો અને શ્રી સાઈબાબા સંસ્થાન વ્યવસ્થાપન મંડળ તરફથી તા. ૩-૧૦-૨૦૦૩ની સભામાં એક મટે મંજૂર થઈ ગયો. એવી રીતે ધણાં વર્ષોથી

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

મનમાં રહી ગયેલું કાર્ય, શ્રી સાઈબાબાની કૃપાથી પૂર્ણ થયુ. કે. શ્રી નિંબાળકરના આ ગ્રંથના પ્રકાશનના આગળના બધા અધિકાર ખૂબજ નિરપેક્ષ ભાવનાથી નિંબાળકર પરિયારે શ્રી સાઈબાબા સંસ્થાનને સૌંધી દીવેલા છે. એમની આ સાઈસમર્પિત સેવા માટે, કે. નિંબાળકરનાં પત્ની શ્રીમતી પ્રમિતાતાઠ તેમજ તેમના સુપુત્રો, સર્વશ્રી વિરેન્દ્રલુ, અજિત, ચંદ્રસેનજ અને રણજિતજનો હું હૃદયથી આભારી છું કે. નિંબાળકરના બંધુ શ્રી જ્યસિંહરાવના કહેવાથી આ નવી સંપાદીત આવૃત્તિનો યોગ થઈ આવ્યો, એમનો પણ હું સહદ્ય આભારી છું.

આ નવી આવૃત્તિ સંપાદીત કરવા માટે શ્રી સાઈબાબા સંસ્થાન તરફથી પ્રકાશનના સંસ્થાનના નિયમોના આધારે આમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. એ બાબતે તે વાખતના આ આવૃત્તિના સંપાદક અને સાઈલીલા સામાચિકની કાર્યકારી સંપાદક શ્રી વિદ્યાધર તાઠેએ વિસ્તૃત રીતે, ‘સંપાદકીય’માં લખ્યું છે.

વાંચકોને સુલભતા થાય માટે આ નવા આવૃત્તિના અક્ષરો મોટા રાખ્યા છે. બે કલરમાં છપાઈ કરીને ગ્રંથ સુંદર અને આકર્ષક કર્યો છે. ગ્રંથ વાંચતી વખતે કંસના લખેલા શબ્દો વાંચવામાં થોડો પ્રવાહ-બંગ થતો હતો, માટે કાઢી નાખવામાં આવ્યા છે. કે. નિંબાળકરના બંધુ શ્રી જ્યસિંહરાવના સંમતિપત્રના આધારે આવા ફેરફાર કરવામાં આવ્યા છે. કંઈપણ ફેરફાર કરવા ખાતર કર્યા નથી, પણ ગ્રંથને વાંચનીય, સુંદર, નવી આવૃત્તિ વધારે સારી થવી, એવો એના પાછળનો ઉદેશ છે. સાઈલીલાના કાર્યકારી સંપાદક શ્રી વિદ્યાધર તાઠે પોતાનો સમય, પોતાનું કાર્ય સંભાળીને જે યોગદાન આપીને પ્રામાણિક પ્રયત્ન કર્યો છે, એ એમની ‘સાઈસેવા’ છે. જેમણે જેમણે આ ગ્રંથનિર્મિતી માટે સહયોગ આપીને સંસ્થાનને મદદ કરી છે, એમનો હું સંસ્થાન તરફથી આભાર માનું છું. શ્રી નિંબાળકરની હૃત્તીમાં આ યોગ આવ્યો હોત તો વધારે સારું થાત પણ ‘સાઈ ઠચ્છા બલિયસી’ એવું કહીને હું ભારા આ મનોગતને પૂર્ણ વિરામ આપું છું. જ્ય સાઈરામ ।

નથી જોઈતું વ્રતનું ઉધાપન । નથી જરૂરી ઉપવાસથી શરીર શોષણ ।

નથી જરૂરી તીર્થયાત્રા પર્યટન । કરવું છે જરૂરી ચરિત્રનું શ્રવણ ॥

દ. મ. સુકથનકર

તત્કાલીન અધ્યક્ષ, શ્રી સાઈબાબા સંસ્થાન, શિરડી.

ચૈત્ર શુ-૧ ગુડી પડવો, શકે ૧૯૨૬

દિ. ૨૧ માર્ચ, ૨૦૦૪

## સંપાદકીય

સાઈ કહેશે તેના અર્થ । પૂરા થશે સ્વાર્થ અને પરમાર્થ ।  
સેવા કોઈદિના જશે વ્યર્થ । અંતે તે કરશે કૃતાર્થ ॥ ૧૫॥

શ્રી હેમાદ્રપંત રચિત ‘શ્રી સાઈ સચ્ચારિત્રના અધ્યાય ૪૬ની આ ઓવી સંપાદકીય લખતાં વારંવાર ધ્યાનમાં આવે છે. લે. કર્નલ કે. મુ. બ. નિંબાળકર લિભિત’ શ્રી સાઈનું સત્ય ચરિત્ર ગ્રંથનું સંસ્થાન તરફથી પ્રકાશન થવું એવી પોતાની ઈચ્છા હતી અને એમની આ ઈચ્છા શ્રી બાબાએ પૂર્ણ કરી છે. સેવા કોઈ દિવસ વ્યર્થ નહીં જય અને બાબા એને કૃતાર્થ કરશે આ લીટીઓ સાર્થક થઈ છે.

સંત જ્ઞાનેશ્વરની, જ્ઞાનેશ્વરીની સમજણ પઢવા માટે ઘણાં ભક્તો સંત એકનાથનું ભાવાર્થ ભાગવત વાચે છે. એવી રીતે જ હેમાદ્રપંત ‘શ્રી સાઈ સચ્ચારિત્ર’ સમજવા માટે કે. નિંબાળકર લિભિત શ્રી સાઈનું સત્ય ચરિત્રનો ગદ્ય ભાષ્યાનુવાદ એ બહુજ ઉપયુક્ત ગ્રંથ છે. એમાં ફક્ત શબ્દાર્થ નથી આપેલા પણ ભાવાર્થપણ છે. અને સુલભભવાથી એનું નિરૂપણ, વિવરણ કરેલું છે. એવું એમને ‘બે શબ્દ’ એવા પ્રાસ્તવિકમાં કહેલું છે. એમના નિરૂપણ, વિવરણની વિશિષ્ટતા એ છે કે એ પ્રસાહણણોથી પૂરેપૂરું ભરેલું છે. એના શબ્દ-શબ્દમાં એમની સાઈભક્તિ, સાઈ-નિષ્ઠા, અને એમના ઉપરની સાઈ-કૃપાના દર્શન થાય છે. ‘આ તો ગ્રંથ નથી પણ અમૃતનો સંચય છે. એવું એમના ગ્રંથનું એકદેરે સ્વરૂપ છે. સાઈની કૃપાનું જ એ અમૃત છે.’

ઇ. સ. ૧૬૮૩ અને ૧૬૮૪માં આ ગ્રંથની બે આવૃત્તિઓ પ્રકાશિત થઈ ગઈ છે. આ બંને આવૃત્તિઓ એમને જ પ્રકાશિત કરી હતી. આ બંને આવૃત્તિઓ કે. મુ. બ. નિંબાળકરની અને એમના બંધુઓની સાઈ સેવાનો ત્રિવેણી-સંગમ જ છે. કે. મુકુંદરાવ નિંબાળકરનું લેખન, બંધુ જયસિંહરાવનું મુદ્રણ અને બંધુ ગોવિંદરાવ દ્વારા સાકાર થયેલું બાબાનું સુંદર ચિત્રનું સુંદર મુખપૃષ્ઠ । એ આવૃત્તિમાં જયસિંહરાવ અને કે. મુ. બ. નિંબાળકરના મુદ્રક અને લેખક તરીકે નામો છિપાયા છે, પરંતુ ચિત્રકાર તરીકે ગોવિંદરાવનું નામ શરત ચૂકથી રહી ગયેલું, શ્રીમતી પ્રમિલાતાઈને મળવા જ હું જ્યારે એમના નિવાસસ્થાને મુંડવા ગયો ત્યારે મને આ અજણ માહિતી જાણવા મળી.

કે. નિંબાળકર કૃત ‘શ્રી સાઈનું સત્ય ચરિત્ર’ આં ગ્રંથમાં (આવૃત્તિ ૧/૨) એમાઝે કે. ગોવિંદ રધુનાથ દાભોળકર ઉદ્દેશ્ય હેમાદ્રપંત લિભિત, શ્રી સાઈસચ્ચારિત્રનું ગદ્ય ભાષ્ય-દીકા એવું સ્પષ્ટતાથી કહ્યું છે, તો પણ આ ગ્રંથ-દીકા નથી. દીકા એટલે કે ગ્રંથનું ખંડન-મંડન, પૂર્વક્ષ-ઉત્તરપક્ષ હોય એવું આનું સ્વરૂપ નથી. ‘સાઈ સચ્ચારિત્રની’ ઓવીઓનું ગદ્યભાષામાં અર્થ સમજાવેલું આ એકમાત્ર ગ્રંથ છે. આવી લિટી કે. નિંબાળકરે ગ્રંથમાં (આવૃત્તિ ૧/૨) છિપાઈ છે. હેમાદ્રપંતની ઓવીઓનો ગદ્યમાં અર્થ સમજાવતાં, પ્રવચનકારની લેખ વિવરણ-નિરૂપણ કર્યું છે. અધ્યાયના છેલ્લે વધારાની દીકાના નામે કંઈ વિચારો વ્યક્ત કર્યા છે. એમના વિચારો ભાષ્ય સ્વરૂપમાં છે, એટલે આ ગ્રંથને ભાષ્ય-ગ્રંથ કહીએ. એટલે આ ગ્રંથન હેમાદ્રપંત કૃત ‘શ્રી સાઈ સચ્ચારિત્ર’ ગ્રંથનો ગદ્ય ભાષ્યાનુવાદ કહીએ એમાં બે મત નથી, એન્ય યોગ્ય અને સાર્થક છે.

આ પ્રસ્તુત થયેતી આવૃત્તિ શ્રી સાઈબાબા સંસ્થાન તરફથી પ્રકાશિત છે અને આગળના પ્રકાશનના બધા અધિકાર શ્રી નિંબાળકર કુદુંબીઓએ સમર્પિત ભાવનાથી સંસ્થાનને આપી દીધેલા છે. સંસ્થાનના નિયમોને અનુલક્ષીને જુની

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

આવૃત્તિમાંથી સુયોગ્ય સુધારો કરેલો છે અને કરતી વખતે કે. નિંબાળકરના મૂળ લખાણને જરી પણ આંચ નહીં આવે, એની અમે કાળજી લીધી છે. સંસ્થાનના નિયમ અનુસાર કંઈ વધારાનું અડચાણદ્વારા લખાણ કાઢી નંબાવ્યું છે. શ્રી બાબાનું જન્મ સ્થળ, તિથિ, માતા-પિતા, ગુરુ આ બાબતોમાં સંસ્થાનની એક નિશ્ચિત ભૂમિકા છે. હેમાઉપંત કૃત શ્રી સાઈ સચ્ચયરિત્ર ગ્રંથને સંસ્થાને પ્રમાણિત લેખ્યો છે. એમાં જે બાબાની માહિતી નથી, જન્મગામ, માતા-પિતા, ગુરુ એ સંસ્થાન માનતી નથી. તેમજ શ્રી બાબાના અવતાર તરીકે બીજે કોઈ વ્યક્તિને સંસ્થાને માન્યતા આપી નથી. સંસ્થાનના આ મતાનુસાર શ્રી નિંબાળકરનાં ગ્રંથનું કેટલુક લખાણ અમે કાઢી નાખ્યું છે.

કે. શ્રી નિંબાળકરના મૂળ ગ્રંથમાં કંસમાં વારંવાર લખાણનો ઉલ્લેખ આવતો હતો. એના લીધે વાચકોને અગવડતા થતી હતી, વાચનમાં વિક્ષેપ થતો હતો. કંઈ ભક્તોની માગ હતી, અને એમના બંધુ જ્યસિંહરાવે સંસ્થાનને લખેલા પત્રમાં પણ એવું જ જણાવ્યું હતું, કે એ કંસમાંનો ઉલ્લેખ કાઢી નખાય તો વાંધો નથી. બાકીના લખાણમાં કંઈ ફેરફાર કરવો નહીં, એવું સ્પષ્ટતાથી જણાવ્યું છે. એ ધ્યાનમાં લઈને અમોએ એ લખાણને કાઢી નખાવ્યું છે. જ્યાં આવશ્યકતા લાગી ત્યાં એવોને એવો જ રખાવ્યો છે. હેમાઉપંત લિખિત શ્રી સાઈ સચ્ચયરિત્ર તો સો ટચનું શુદ્ધ સોનું જ છે. અને કે. નિંબાળકરનો એના ઉપરનો ગદ્ય ભાષ્યાનુવાદ એ સોનાનો સુંદર, આકર્ષક દાગીનો છે. દાગીનાને નવું સ્વરૂપ આપવા દીપવું પડે છે. અને એ સૌંદર્યપૂર્વક વાત છે. સંસ્થાન આવૃત્તિ એ કે. નિંબાળકરની મૂળ આવૃત્તિનું સુધારેલું સ્વરૂપ છે. સાઈબક્ત સહાનુભૂતિ અને ઉદ્ઘાત ભાવનાથી જુઓ એવી આશા છે.

જ્ઞાનેશ્વર મહારાજે, જ્ઞાનેશ્વરીમાં કહ્યું છે, ‘કંઈપણ ઓછાપ હોય, તેને સુધારીને આપ્યું હોય તો એનો સ્વીકાર કરવાની વિનંતી કરું છું.’ એજ ભાવના મનમાં રાખી છે. આવૃત્તિમાં જે કંઈ ઉત્તમ હશે એ હેમાઉપંત અને કે. નિંબાળકરનું છે, અને આમાં જે કંઈ ખામીઓ હશે તે અમારી છે. શ્રી સાઈબાબા સંસ્થાનની મુદ્રાંકિત કરેલી પ્રસ્તુત આવૃત્તિ સાહિત્ય કરતી વખતે ‘વાચકમિત્રોની તૃષ્ણાની પૂર્ણતા થથી’ આટલી જ મનિષા છે.

કે. નિંબાળકર એ લહવૈયા સૈનિક હતા, એમનો સ્વભાવ રોકડા સંભળાવી દેવાનો હતો. એમની વૃત્તિ અભ્યાસક અને ઉડાણમાં ઉત્તરવાની હતી. દીર્ઘ દશિ, પ્રભર જ્ઞાનનિષ્ઠા, બધુજ અલગ તરી આવતું હતું. કર્મ, ભક્તિ, જ્ઞાનનો મનોજ્ઞ ત્રિવેણી સંગમ એમની પાસે હતો. જ્ઞાન એટલે શું? *Know to unknown* આ અર્થથી ભરેલું ભક્તિસાધનાથી પરિપૂર્ણ એમનું જીવન એક શોધ-યાત્રા-જ્ઞાન-યાત્રા હતી. ગ્રંથના નિરૂપણમાં ગીતા, ભાગવત, ઉપનિષદ્દો જેવા પ્રાચીન વાડમયોના દાખલાઓ, એમના વિદ્યાભ્યાસનું દર્શન કરવે છે. એમનું આવું યોગદાન, એમની વ્યાપક સાઈબક્તિનું ઉદ્ઘાત પરિણામ છે.

ધારણાં લેખકો નામ માટે લખે છે, કોઈ પૈસા માટે, તો કોઈ પુરસ્કાર, માન-સન્માન માટે લખતા હોય છે. કોઈપણ ભૌતિક અભિલાષા ન રાખતાં, પોતાના સ્વાંત સુખ માટે, સાઈબક્ત માટે કે. નિંબાળકરે આ પ્રપંચ કર્યો છે. ઉભરમાં સિસેરવરસો વટાવ્યા પછી, આંખો પેલીપાર પહોંચી હોય છે. એવામાં નિંબાળકર ૭૦૦ પાનનો આ ગ્રંથરાજ લખે છે, આ તો સાઈની લીલા જ કહેવાય!

એવીજ મારી સાઈમાતા | લેખણી પકડાવીને મારા હાથ |

લખાવે છે આ ગ્રંથ | ભક્તોના કાજે || (૩૮:૧૧)

હેમાઉપંતની આ ઓવીને, મૂર્તિ સ્વરૂપમાં જોવી, આ ગ્રંથરાજમાં દેખાય છે. કે. નિંબાળકરનું અનુકરણ કરવા જેવું વૈશિષ્ટ્ય એ છે એમણે જેટલો પરમાર્થ કર્યો, એટલો જ પ્રપંચપણ કર્યો. પ્રપંચતરફ મોઢું ફેરવીને એની ઉપેક્ષા કરીને કેટલાંક પરમાર્થ કરવા જય છે. પણ પ્રપંચને પરમાર્થરૂપ કરવો અને પરમાર્થને પ્રપંચના ભક્તિજ્ઞાનમાં કેવો ફેરવવો એ આઠ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

નિંબાળકરે બતાવી દીધું. આ સંસારને સુખમય કરીશા | અને ત્રણેય લોકમાં આનંદ ભરીશા | આ સંતોનું કહેવું એમણે સાર્થ કરી બતાવ્યું. પોતાની સાથે, બીજાઓના સંસારમાં પણ સાઈ-ભક્તિનો આનંદ ભરી દીધો. એમણે નહીં આશ્રમ સ્થાપ્યો, કે નહીં દરબાર ભરાવ્યો. પોતાને સાઈ-અવતારના ગણાવ્યો. બુવાબાળને ઘિક્કાર કરીને, સાઈભક્તિનો પ્રચાર અને પ્રસાર જગ્યતતાથી કર્યો. આજકાલ ઠગોનું, બુવાબાળનું વધતું પ્રમાણ જોતાં કે. નિંબાળકર જેવા સાઈભક્તોની મોટાઈ નજરમાં વ્યાપી રહે છે.

શ્રી સાઈબાબા સંસ્થાનનું અધિકૃત નિયતકાલીક ‘સાઈલીલા’ ૧૯૨૩ની સાલથી ૮૦ વરસથી મુંબદીથી પ્રકાશિત થતું હોય છે. કે. નિંબાળકર ‘સાઈલીલા’ ના અગ્રણી લેખક હતા. આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થતા પહેલાં, આ ગ્રંથના કંઈ અધ્યાય સાઈલીલામાં પ્રકાશિત થયા છે. આ ઉપરાંત બીજું પણ વિપુલ લેખન સાઈલીલામાં કરેલું છે. એમના સત્યનિષ્ઠ લેખનને લીધે, દિલ્લી સ્થિત એક ઉચ્ચવિદ્યાભૂષિત વિદ્ધાને પોતાનું અપમાન થવાથી, કે. નિંબાળકરને અને સંપાદક તરીકે મને કોઈની નોટીસ આપી હતી. છેવટે કે. નિંબાળકરના પુરાવાના આધારે આ પ્રકરણ બંધ રહ્યું એવા સત્ય નિષ્ઠ લેખકોની આજના ભોડું સમાજમાં જરૂર છે. એટલે એ વાતને તાજ કરી.

કે. નિંબાળકરના ગ્રંથની આ સુધારેલી આવૃત્તિ અનેકોની ઈચ્છાપૂર્તિ છે. એમની ઈરછા ફિલીત થઈ છે. ‘આનંદના સાગરમાં આનંદના તરંગ | એવો આ સુખનો સુપ્રસંગ છે. અને આ સુખદમ્પસંગ સિદ્ધ થવા પાછળ અધ્યક્ષ શ્રી દ. મ. સુકથનકરની કુશળ કાર્યશૈલીએ મોટો ભાગ ભજવ્યો છે. ડૉ. કે. સી. ગ. હેસાઈકૃત, ‘દનંદિન સાઈબોધ’ નામે અલગ ગ્રંથ જેમ ભક્તોને ગમ્યો, ભક્તોએ એનું ઉત્સાહથી સ્વાગત કર્યું તેવું જ પોતીકુંપણ આ ગ્રંથને મળશે, એવી અપેક્ષા છે. આ ગ્રંથના વાંચનથી હેમાઠપંત કૃત શ્રી સાઈસચરિત્ર ગ્રંથનું ભક્તો વાંચન કરશે. અને એવું થવાથી, સંસ્થાનના આ પ્રકાશનને સાર્થકતા મળશે, જય સાઈરામ |’

પૂર્ણ થતાં અવતારકૃતિ | અંત થઈ જતાં પાર્થિવ કૃતિ |  
આ ગ્રંથ છે વાડમય મૂર્તિ | ક્ષણોક્ષણ આપશે સાઈ-સમૃતિ ||

- વિદ્યાધર તાંడ  
સંપાદક

## લેખકના બે શબ્દો....

ઇ.સ. ૧૯૮૮ની સાતના જૂન મહિનામાં કે. ગોવિંદ રઘુનાથ દાભોલકર ઉર્ફી હેમાદ્રપંતે શ્રી સાઈ સત્ય ચરિત્ર આ મરાઠી ભાષાનો ઓવીબદ્ધ ગ્રંથ લખીને પૂર્ણ કર્યો. તેને લખાયે આજરોજ ૬૪ વર્ષ પૂરાં થવા આવ્યાં છે. શ્રી સાઈસમર્થનો આ એક માત્ર આધારભૂત ગણી શકાય એવો શ્રેષ્ઠ ગ્રંથ છે. થોડામાં કહીએ તો, સાઈભક્તો માટે આ ભાગવત ગીતા, કુરાન કે બાઈબલ છે એમ કહી શકાય. તેમજ આધ્યાત્મિક દાખિલે મરાઠી ભાષામાં લખેલ જાનેશ્વરી, એકનાથી ભાગવત, દાસભોધ કે શ્રીગુરુચરિત્રની બરાબરીનો ગ્રંથ છે. ઉપરના બધા ગ્રંથોનો મરાઠી ગદ્ય અનુવાદ કે ભાષ્ય તેમજ આતોચના વખતોવખત અનેક પ્રસિદ્ધ લેખકો દ્વારા પ્રસ્તુત થઈ ચૂક્યાં છે. પરંતુ શ્રી સાઈ સત્ય ચરિત્ર સંબંધી આવો ગ્રંથ હજુ સુધી કોઈએ પ્રસિદ્ધ કરેલ નથી.

શ્રી સાઈ સત્ય ચરિત્રના મરાઠી ભાષા ઉપરના ગ્રંથના હિસાબે ભલે પહેલો છે, તો પણ એ પ્રાચીન સંતોની સાહિત્યિક સંપત્તિ હોવાને કારણે સમજવા માટે, અવલોકન વગેરે માટે આજકાલની પેઢી માટે આ જરા અધરો થઈ પડે છે. એમાંથી કે. દાભોલકરને સંસ્કૃત અને મરાઠી ધાર્મિક ગ્રંથોનો સારો એવો ઉંડો અભ્યાસ હોવાને કારણે, એમના ગ્રંથમાં સંસ્કૃત અને પ્રાચીન મરાઠી ભાષાનો શબ્દ પ્રયોગ વધુ પ્રમાણમાં થયેલો છે. વેદાંતના ગહન શબ્દોનો પણ ભાવાર્થ કોઈએ સમજલ્યા સિવાય વાંચનાર સમજલ્ય તેમ નથી. પેઢી માટે અને આવનારી પેઢીઓ માટે એમાં વપરાયેલા કેટલાક શબ્દો આધુનિક સમજમાં પ્રચલિત શબ્દો દ્વારા સમજલવવા જોઈએ. જેમ કે એમણે આ વસ્તુઓ તો જોઈ પણ ન હોય. દા.ત. ચૂલો, સંપુર્ણ, ઘંઠીના પથર, ખાંડવા માટેનું શાંભેલું વગેરે.

ઉપર જણાવેલ વાત મારા ધ્યાનમાં આવતાં મને એમ લાગતું હતું કે શ્રી સાઈ સત્ય ચરિત્રની દ્વરેક ઓવીઓના શબ્દે શબ્દનો ભાવાર્થ આધુનિક મરાઠી ભાષામાં સવિસ્તારપણે, આતોચના સાથે કોઈએ તો કરવો જોઈએ. હું છેલ્લા ૨૩ વર્ષોથી આ ગ્રંથ નિયમિત રીતે વાંચતો આવ્યો છું. અને અનેક વખત એનાં પારાયણો પણ કર્યા છે. મૂળમાં જાણવાની જ્ઞાસાવાળો સ્વભાવ અને ઉંડો અભ્યાસ કરવાની વૃત્તિ હોવાને કારણે હું આની દ્વરેક ઓવી ક્યારેક શબ્દકોષની મદદ લઈને, તો ક્યારેક જાણકાર વ્યક્તિઓની સાથે ચર્ચા વિચારણા કરીને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરતો હતો. સાઈનાથ મહારાજની કૃપાથી એ કામમાં મને સારો એવો યશ પણ મળ્યો. નિવૃત્ત થયા પછી કોલેજમાંનું સંસ્કૃત ભાષા ઉપરનું જ્ઞાન થોડું વધારવા માટે ભગવદ્ગીતા, ભાગવત, ઉપનિષદ વગેરેનો અભ્યાસ કર્યો. અને અમુક મોટા પ્રભર મરાઠી સંતોની પોથીઓનું પણ સમજુને વાંચન કર્યું. એમાંથી સંપાદન કરેલ થોડુંક જ્ઞાન સાઈભક્તો માટે અહીં રજૂ કરીને બાબાની સેવાનો લાભ શા માટે લેવો નહીં એવો મને વિચાર આવ્યો.

શરૂઆતની ચકાસણી ખાતર શ્રીસાઈ સત્યચરિત્રનો અર્થ સમજવામાં વધારેમાં વધારે અધરા ગણાતા અધ્યાયો ૧૬, ૧૭, ૩૮ અને ૫૦નો શબ્દસ: ભાવાર્થ મરાઠી ભાષામાં લખીને શ્રી સાઈલીલાના જન્યુઆરી ૧૯૮૭ થી ઓગસ્ટ ૧૯૮૭ના અંકોમાં પ્રસિદ્ધ કરાવ્યો. એનો વાંચકો તરફથી ઘણણો સારો પ્રતિભાવ મળ્યો. ભક્તોના અભિનંદનના પત્રો પણ ખૂબ મળ્યો અને શ્રી સાઈલીલાના ૧ થી ૫૩ સુધીના બધા ૪૪ અધ્યાયોનો ગદ્ય ભાવાર્થ પ્રસિદ્ધ કરવો જોઈએ એવું વિનંતી સાથે સૂચન કર્યું.

## શ્રી સાઈનું સત્ય ચટિત્ર

એ ઉપરથી ૧૬૮૭માં દશોરાના દિવસે મુહૂર્ત કઢાવી શ્રીસાઈ સત્યચરિત્રના ૧ થી ૫૩ અધ્યાયોની આલોચનાનો ગદ્ય ભાવાર્થ લખવાનું બીજું ઝડપું. સહગુરુ સાઈમહારાજની કૃપાથી ૧૬૮૭માં દશોરાના દિવસે બધા ૯ અધ્યાયો લગભગ લખાઈને તૈયાર થઈ ગયા. ત્યારબાદ એને સમજુને અમુક અધ્યાયોની ફરીથી થોડી વધારે આલોચના લખી. પણ પ્રસ્તાવના રૂપે શરૂઆતમાં એની સાથે થોડા લેખો પણ જેહચા. આમ લગભગ ૧૩૦૦ હસ્તલિખિત પાનાઓનો ગ્રંથ મેં પૂર્ણ કર્યો.

આ પહેલાં એકનાથી ભાગવત, શાનેશ્વરી વગેરે પોથીઓનો ગદ્યમાં અનુવાદ પ્રસિદ્ધ થયો છે, એમાં ખાસ કક્ષીને ઓવી દીઠ શાબ્દીક અર્થ ૯ ખાસ લખવામાં આવ્યો છે. ઓવીઓમાંનો ભાવાર્થ સમજન્યો નથી. તે રીતે આધ્યાત્મિક અને ભાવાર્થપૂર્ણ શબ્દો પણ સમજન્યા નથી. અમુક અનુવાદોમાં સારા શબ્દોના અર્થ અથવા વિશેષ માહિતી ક્રમાંક સાથે તે પાનાંઓની નીચે પ્રકરણાના અંતમાં અથવા તો ગ્રંથના અંતમાં આપેલા હોય છે. પરંતુ વાંચકો સાધારણ રીતે એને વાંચીને સમજવા માટેનું કષ્ટ ઉઠાવતા નથી. માટે મારા આ ગ્રંથમાં આલોચના સહિત ગદ્ય ભાવાર્થમાં નીચેની નવી જ રીત મેં અપનાવી લીધી છે.

- (૧) મરાઠી પોથીઓમાં અધ્યાયોની ઓવીઓ અથતી ઇતિ સુધી સરળંગ લખેલી હોય છે. બીજી કથા શરૂ થતાં અથવા તો વિષય બદલાતાં પણ અધ્યાયના ભાગ પાડવામાં આવતા નથી. જેને લીધે ઘણીવાર અર્થ સમજવો અધરો પડતો હોય છે. તેથી મેં દેરેક ઓવીઓનો ભાવાર્થ છૂટો જ આપ્યો છે. તે ઉપરાંત લખતે વખતે અધ્યાયનો વિષય સમજવો સહેલો થઈ પડે તે માટે, જુદી કથા પ્રમાણે અથવા તો વિચારો પ્રમાણે ઓવીઓ ભેગી કરીને અધ્યાયોના ફકરા પાડ્યા છે, અને છેલ્લે એ બધી ભેગી કરેલી ઓવીઓનો ક્રમાંક આપેલ છે.
- (૨) મૂળ પોથીના સંસ્કૃત અથવા મરાઠી ભાષાના અધરા શબ્દો કે વાક્યો કૌંસમાં આપ્યાં છે. દા.ત. બકરાના ગળાની પાસે બંને બાજુ નીચે માંસલ ગોટીઓ જેવા અવયવ પ્રમાણે (અન્જગલ સ્તન). પેલેપારના કિનારા માટે (પૈલેપાઢ). કેટલીક વખત તો સંધી પણ છોડીને લખેલી છે. શિરડી જવા માટેની ઇચ્છાની જગૃતિ (શિરડી + ગમન + ઇચ્છા + ઉદ્ભોધ), બ્રહ્મ અને આત્માનું ઐક્ય (બ્રહ્મ + આત્મા + ઐક્ય). હેતુ એ કે બકતોને મૂળ પોથીમાંના શબ્દોની ઓળખ થવી અને એનો અર્થ પણ તેઓ સારી રીતે સમજ લઈ શકે. પારાપણ કે નિત્ય વાંચન તો પ્રસાદરૂપી મૂળ પોથીનું જ કરવું જેઠાં. તે સમયે એનો અર્થ સમજુને વાંચતા આવડવી જેઠાં.
- (૩) પોથીમાંના સંસ્કૃત શબ્દો જેવા હતા તેવી જ રીતે તેના સ્પષ્ટીકરણાર્થી આગળ અર્થ કૌંસમાં જણાવવામાં આવ્યા છે. દા. ત. ભાલચંદ્ર (જેના કપાળ ઉપર ચંદ્ર શોભા આપી રહ્યો છે એવા) ભભરણ (દાંત તૂટેલા).
- (૪) આ આધ્યાત્મના તાંત્રિક શબ્દો કૌંસમાં સમજવીને કહેવામાં આવ્યા છે. દા.ત. અદ્વૈત (જગત કે બ્રહ્મ અથવા જીવાત્મા અને પરમાત્મા એ જુદા નથી, (પણ એક જ છે એવો મત) પુરાણોમાં અથવા તો વર્તમાનકાળના વિશેષ નામો અથવા તો સ્થળો વિષેનું સ્પષ્ટીકરણ અથવા તો વિશેષ માહિતી આપવામાં આવેલી છે. દા.ત. અગસ્ત્ય (એ મુનિ ચિત્રા એટલે વરુણના પુત્ર. સમુદ્રમાં સંતાપેલા કાલેય નામના દૈત્યને મારી નાખવાની દેવોની વિનંતીથી એકી સાથે આપો સમુદ્ર પી ગયા હતા.) મેરુપર્વત (હિમાતયની ઉત્તરે આવેલા સાત ખંડોના મધ્ય ભાગમાં અતિશ્રેષ્ઠ પર્વત), પ્રયાગ (અલ્હાબાદમાં ગંગા યમુના નદીઓના સંગમ પર આવેલું પવિત્ર ક્ષેત્ર) તેમજ જૂની પેઢી સારી એવી માહિતી હોય છે. પણ નવી પેઢી માટે પરિચય વગરના આવા શબ્દો જાહેરી જેઠાં સમજવીને લખવામાં આવ્યા છે. દા.ત. ખાંડણીયો-ખાયણીયો (અનાજ

---

### શ્રી સાઈનું સત્ય ચરિત્ર

---

ખાંડવા માટે ધરમાં પદ્થર કોચીને બનાવેલ ખાયણીઓ) મુરળી (ખંડોભાને અર્પણ કરેલી સ્ત્રીઓ અથવા તો દેવદાસીઓ).

- (૫) સમાન વિચારોની બીજી અધ્યાયોની ઓવીઓ, ક્યાંતો ગીતા, ઉપનિષદના સંસ્કૃત ગ્રંથના ઉતારા અથવા તો આખ્યાનો સુદ્ધાં પ્રસ્તુત અધ્યાયોમાં વિચાર અથવા તો તત્ત્વ સારી રીતે સમજવા માટે, ક્યારેક ક્યારેક વિસ્તૃતપણે આપેલા છે. જેમકે અધ્યાય રહમાંની ‘શક્તિ આ પ્રચંડ નામની’ આ રહમી ઓવીના સંબંધમાં પહેલાના અધ્યાય રજની રચના, ૨૮૫-૨૮૬ ઓવીઓની એટલે ‘નામ પાપના પર્વત ફોડી । નામ કાળની ગર્દન તોડી ।’ વગેરેની યાદ દેવડાવી આપી છે. તેવી જ રીતે અધ્યાય તરમાં ‘ઉદ્ઘ્રભૂળ સંસારવિટ્પ’ એટલે કે મૂળ ઉપર આકાશમાં જેના હાથ હોય એવા સંસાર વૃક્ષ વિષેનું કૌંસમાં સ્પષ્ટીકરણ કરતી વખતે ગીતાના અધ્યાય ૧૫નો શ્લોક ૧ અને કઠોપનિષદના અ. ૨ વલ્લી. ૩ મંત્ર ૧ ધ્યાનમાં લઈ સમજવવામાં આવ્યો છે. તેમજ અધ્યાય ૧૮ની ઓવી જુદે ‘હિરુણ ગર્ભ પદ લગીન । બધા ઉત્કર્ષે જે વિરક્ત । એ જ બ્રહ્મવિદ્યાનો ખરો હક્કાર । અનાસક્ત બીજા બધામાં ॥’ આ ઓવી પરની આલોચના લખતી વખતે સ્પષ્ટીકરણ ખાતર કઠોપનિષદમાંનું નચિકેત અને બૃહદારણ્યક ઉપનિષદની મૈત્રેયીની કથા કહીને એનાં પ્રસિદ્ધ સુભાષિતોનો ઉતારો પણ આપ્યો છે.
- (૬) ચાલુ અધ્યાયના મહત્ત્વના વિષયોનું વિસ્તૃત વિવરણ કરવા માટે, તેવા જ અનેક અધ્યાયમાં વિખ્રેલા એકાદ વિષયની એક જગ્યા ઉપર સમાલોચના કરવા માટે અમુક અધ્યાયોની સમાપ્તિ પછી, ‘વધારાની આલોચના’ જેડવામાં આવેલી છે. દા.ત. અધ્યાય ૪૮ના અંતમાં સાઈબાબાના જન્મ વિષેના વિવિધ વિચારો અને મતો લઈને એની સવિસ્તર ચર્ચા કરી છે. તેવી જ રીતે અધ્યાય ૩૫ના અંતે પહેલાંના અધ્યાય ૩૩ અને ૩૪માં ફેલાયેલી ઉદ્દી વિષેની માહિતી બેગી કરીને એના ગુણોની અને એને વાપરવા માટેની પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

દૂકમાં જણાવવાનું હોય તો આ ગ્રંથમાં કરેલો દરેક ઓવિઓનો અર્થ તે ફક્ત ગદ્ય ભાવાર્થ જ નથી, પણ કોઈ પ્રવચનકારે શ્રી સાઈ સત્યચરિત્રની ઓવીઓનો અર્થ સરળ ભાષામાં સમજાવ્યા હોય એ પ્રમાણે લખ્યો છે. એ કહેતી વખતે જેવી રીતે પ્રવચનકાર જે પ્રમાણે વિષયોના અંતરનો દોષ દૂર કરીને એ ઓવીઓના અર્થનું યથાસ્થાન વિવેચન કરે છે, વિષયોના અનુસંધાનમાં બીજી ગ્રંથોમાંના સમાન અર્થનાં વચ્ચે સમજાવે છે. અથવા તો એકાદ કથા કે અનુભવ વર્ણિયે છે તે જ પ્રમાણે મારું આ કૌંસનું જે તે જગ્યાનું લખાણ છે. જે પણ વાંચકોને એની પહેલેથી જ જણા હશે કે જેમને એની જરૂર નથી એવાએ એને છોડી દેવા માટે કૌંસની આગળ લખેલા સંદર્ભમાં વાંચવાની શક્યાત્મક કરવી જેથી કરીને અનુસંધાન તૂટે નહીં.

ખરું પૂછો તો આ ગ્રંથમાં ખરું પોતાનું ખાસ કંઈ જ નવું નથી. તેમજ એ માટેની મારી યોગ્યતા પણ નથી. હું કોઈ સાહિત્યકાર નથી. સાઈમાલિયે જ મારી પાસેથી આ બધું લખાવ્યું છે. મારી ઉંમરના ૭૦ વર્ષ પૂરા થઈ ગયા છે. આંખોમાં મોતિયાની અને જામરની એ બનેની તકલીફ છે. અને એને લીધે વચ્ચે આંખની શક્કાંદું. અને એ માટે ગુરુકૃપા સિવાય બીજે કચ્ચો આધાર હોઈ શકે ? આ લેખનકાર્ય ખાતર મને શ્રી સાઈસમર્થની કૃપાથી નીચે જણાવેલ સંતોના આશીર્વાદ મળ્યા હતા.

(૧) મુંબઈ નિવાસી પ. પૂ. બ્રહ્મલીન સ્વામી શ્રી રામભાબી

(૨) સુરત નિવાસી પ. પૂ. શ્રી બાપુ મહારાજ ટાઈ

## શ્રી સાઈનું સત્ય ચરિત્ર

(૩) બેંગલોર નિવાસી પુ. પાદ. શ્રી. શ્રી. સ્વામી વિદ્યાનારાયજા તીર્થ

એમનો ઉપકાર કેવી રીતે માનયો ? ફક્ત એમના ચરણોમાં મસ્તક જ નમાવવાનું રહેવું ! સંસ્કૃત ભાષાના ગહન શબ્દોના અર્થે અને આધ્યાત્મિક ભાવાર્થ સમજવા માટે પુનાના ડેક્કન કોલેજના ડૉ. ટી. એચ. શ્રીનિવાસ શાસ્કી અને વડોદરાના રાષ્ટ્રપતિ સન્માનિત શ્રી અરુણોદય ન. જાની આ સંસ્કૃતના મહાન પંડિતોએ મને માર્ગદર્શન આપ્યું એ બદલ હું એમનો સદ્ગત ઝાણી છું.

શરૂઆતના ચાર અધરા અધ્યાયોના ગદ્ય ભાવાર્થ એ સમયના પ્રકાશન સમિતિના અધ્યક્ષ શ્રી વિ. બા. ઐર અને કાર્યકારી સંપાદક શ્રી સદાનંદ ચેંદવાણિકના સહકારથી શ્રી સાઈલીલા મેગેઝીનમાં પ્રસિદ્ધ થઈ શક્યા, અને ત્યારબાદ અધ્યાય ૧ થી ૨૪ શાબ્દિક ગદ્ય ભાવાર્થ તે સમયના કાર્યકારી સંપાદક શ્રી ચકોર આજગાવકર, ડૉ. વિ. વા. સાતપૂરક અને શ્રી અરુણ તામહણકર અને આ બધાના મહદનીશ શ્રી સુનીલ રણેના સહકારથી કમશા: પ્રસિદ્ધ થયા. અને એને લીધે ભક્તોની પ્રતિક્રિયા સમજી શકાઈ. ત્યાર પણી બધા જ અધ્યાયોની ગદ્ય ભાષ્ય આતોચના લખવા માટે મને પ્રેરણા અને શક્તિ મળી. માટે આ બધાનો જેટલો આભાર માનું એટલો ઓછો તો ખરો !

સાચું પૂછો તો આ બધા અધ્યાય ભેગા ગ્રંથરૂપે શિરડી શ્રી સાઈબાબા સંસ્થાન જ પ્રકાશિત કરે એવી ઘણી જ અંગત ઈચ્છા હતી. કારણ કે આ બાબતમાં સંસ્થા સમક્ષ હતી. એ માટેની બધી જ સગવડ તેની પાસે ઉપલબ્ધ હતી. એ કાર્ય એમણે હાથ ધર્યું હોત તો આ ગ્રંથ વ્યાજબી ભાવે મળી શક્યો હોત. આ કારણે હું બે વર્ષ સુધી સતત પ્રયત્નો કરી રહ્યો હતો. મેં મારા તરફથી સર્વ હુક અને તે પણ વિનામૂલ્યે આપવાની તૈયારી બતાવી હતી. પરંતુ અત્યંત ઐદની વાત એ છે કે, સંસ્થાને મારી કોઈપણ વિનંતી ગ્રાહ્ય રાખી નહીં. પણ એમણે મારા લખેલા બધા જ ગદ્ય અનુવાદોને શ્રીસાઈલીલામાં કમશા: પ્રકાશિત કરવા માટેની અનુમતિ આપેલી એ બદલ શ્રી સાઈબાબાસંસ્થાન શિરડીનો હું ઝાણી તો અવશ્ય છું જ.

ભક્તો તરફથી માત્ર ગ્રંથ છાપવા એક સરખી વિનંતીઓના ભલામણપત્રો અને પૂછપરછ, વણથંભ્યા ચાલુ જ રહ્યાં હતાં. શ્રી સાઈલીલામાં કમશા: અધ્યાયો છપાઈને આવતા હતા, તો પણ ભક્તોને એ બાબતનું પૂર્ણ સમાધાન ન હતું. એકાદો અંક ન મળે કે આધો પાછો થઈ જય તો પણ એની કડી મળતી નથી. બરાબર તે સમય સુધીમાં ત્રીસ અંક પ્રગટ થયા હતા. અને તે બધાને સંભાળીને રાખવા એ મોટી જહેમતનું કામ હતું. એ સિવાય બાકી રહેલા બીજ રદ અધ્યાયો બે મહિનામાં એક વખત છપાઈને આવતા એટલે કે માટે વધારાના ૫-૬ વર્ષની રાહ જેવી પડે તેમ હતી. અમુક ભક્તોની ઉભરને કારણે તેઓ વિચારતા કે આગળનું વાંચન વાંચવા માટે મળશે કે નહીં, એ બાબતમાં પણ શંકા હતી. છેલ્લે ભક્તજનો માટે મેં એમ વિચાર્યું કે આ ગ્રંથનું છપાઈ કાર્ય મારે પોતેજ હાથ ધરવું. ખરું જેતાં તો મારા જેવા નિવૃત્ત સરકારી કર્મચારી માટે આ જંગી ખર્ચો ઉદાવલો તે મારા ગજ બહારની વાત હતી. તેમજ સાથે સાથે એ કાર્ય જોળી ફેલાવીને પૈસાનું દાન માગતા ફરવું એ મારા જેવા સૈનિકને માટે શક્ય ન હતું. પરંતુ એક દિવસ મને અચાનક સાઈસમર્થે થોડું આર્થિક અને માનસિક બળ પૂરું પાડ્યું. અને મેં ગ્રંથની તપાસ અને અક્ષર મેળવવાનું કામ શરૂ કરાવવા માટે નક્કી કર્યું. એ પ્રમાણે મારા સાઈભક્ત મિત્ર શ્રી વિલય વાડેકર મારફતે પૂનામાં બાળઉદ્યાન પ્રેસના શ્રી પુ. સ. સહસ્રબુદ્ધે અને પ્રુફરિડર શ્રી શ. ન. સરદેશપાઠેનો મેં સંપર્ક સાધ્યો અને નવાઈની વાત એ બની કે બીજ દિવસે મારા લધુબંધુ ચિ. જ્યસિંહનું અચાનક પુના આવવાનું થયું. એનું પોતાનું વડોદરા ખાતે ઓફસેટ છાપખાનાનું છે. તે મારી વાત સાંભળીને બોલ્યો કે આ કાર્ય મારે માથે લઈ છું. હું છાપકામ કરી આપીશ. એ સિવાય પણ અમુક સાઈભક્તો અને સગાબહાલાઓએ કાર્ય માટે ફાળો સ્વેચ્છાએ ઉધરાવીને શરૂઆત કરી. કેટલા બધા ઉપકારો છે બધા લોકોના !

એકંદરે આના ઉપરથી મને લાગ્યું કે ગ્રંથ છપાઈને મારા દ્વારા જ પ્રસિદ્ધ થવો એવી શ્રી સાઈનાથ મહારાજની પોતાની

---

### શ્રી સાઈનું સત્ય ચરિત્ર

---

ઇચ્છા હોવી જેઠાએ. એવું ધારી લઈને હું ખૂબ જ ઉત્સાહથી કાર્યને આગળ ધપાવવા લાગ્યો. હવે મારી કલ્પના પ્રમાણે ગ્રંથનો આકાર અને બાંધણી અક્ષરનો ભરોડ અને શુદ્ધતા, ચિત્રોના રંગો અને ગોઠવણી કરવાનું સરળ થયું માટે ઘણો જ આનંદ આવવા લાગ્યો. ખરુ પૂછો તો પોતાની નિયમિતની ‘સાઈ-સાધના’ અને અન્ય સાઈ વિષેનાં લેખનકાર્યો છોડીને આ ભાંજગડમાં પડવાની મારી જરા પણ ઇચ્છા ન હતી, પરંતુ આ પણ એક શ્રી સાઈબાબાની આક્ષા જ છે. એમ સમજુને હું એમાં ઓતપ્રોત થઈ ગયો. તેમજ શ્રીસદ્ગુરુ સાઈ સમર્થની કૃપાથી આ ગ્રંથ ભક્તોના હાથ સુધી પહોંચાડવા માટેની મને મારા નસીબે યારી આપી જેથી મારું જીવન ધન્ય બન્યું. આને પણ એક બાબાની પરમ કૃપા જ ગણાય.

સાઈ એવા દ્વારા સાગર | કૃપા કરીને તેમણે મુજ પર |  
તેથી જ થયો વાંચકને સાદર | ગ્રંથ મંગલ કારક આ ||૧૨||  
આ ગ્રંથ રૂપી સંત એવા | મારા પૂર્વ પૂણ્યાધિના હિસાબે |  
લઈ તે દેવે અપનાયા | આભારી દેવનો તેથી હું ||૧૩||

પૂના, ગુરુવાર  
શ્રી રામનથમી ૧૫૮ એપ્રિલ  
સને ૧૯૮૭

આપનો નમ્ર  
સ્વ. લે. કર્નલ મુ. બ. નિંબાળકર  
(નિવૃત્ત)

## અનુવાદકના બે શખદો

માર્ગથી વિખુટા પડેલા માનવોને તેના મૂળ માર્ગ તરફ ઢોરી જવા માટે પરમેશ્વર સગુણ સાકાર રૂપે પૂછ્યી ઉપર ગ્રગઠ થાય છે. જ્યારે પોતાનું કાર્ય પૂરુ થાય છે ત્યારે પોતાનું સ્વરૂપ-શરીર-છોડીને તેના મૂળ તત્ત્વમાં ભળી જાય છે. શિરડીના સાઈબાબા પણ પરબ્રહ્મનું સ્વરૂપ હતા. તેમણે શિરડીમાં રહીને અનેકનાં દુઃખ દર્દ મીટાવ્યાં. વ્યસનીઓને વ્યસન છોડાવ્યાં. અરસપરસના ભતભેદો દૂર કરીને ધાર્મિક ઝગડા મિટાવ્યા. ભારેખમ ઉપદેશ આપવાને બદલે વાત વાતમાં સૂચનો કરીને ધર્મનો મર્મ સમજાવ્યો. તેમ છતાં તેમણે પોતાને ભગવાન તરીકે જહેર ન કર્યા. એ તો કહેતા કે ‘અલ્લા માલિક હૈ.’ એ સાઈનાથનું જીવનચરીત્ર પંડિત દાભોળકર ‘હેમાદ્પંતે’ બાબાની હૃતાતીમાં લઘ્યું. તે ચરીત્ર કે જે ‘શ્રી સાઈ સત્યચરિત્ર’ તરીકે ઓળખાય છે તેની ઉપર સ્વ. કન્ચલ મુરુંદરાવ નિંબાળકરજીએ ભાષ્ય લઘ્યું.

મૂળ આ ભાષ્ય મરાઈ ભાષામાં લખાયેલું છે. એના સર્વ અધિકાર શ્રી સાઈબાબા સંસ્થાન પાસે આપેલા છે. શ્રી સાઈનું સત્યચરિત્ર મરાઈનું ગુજરાતી અનુવાદ કરવાનું સંસ્થાને જ્યસિંહ નિંબાળકરને સૌંપવામાં આવ્યું છે. તેનું ગુજરાતીમાં અનુવાદ કરવા માટે તેમણે મને સૂચન કર્યું. મારે માટે તે ઘણુંજ કઠીન કાર્ય હતું. છતાં સાઈની દીર્ઘા હું આ કાર્ય કરું તેવી હશે એમ સમજને મેં હા પાડી. મરાઈ ભાષાનો હું જાણકાર છું એમ તો ન કહી શકું, પરંતુ મરાઈ ભાષા મારાથી સાવ અન્નાણી પણ નથી.

મૂળ ભાષ્યમાં વાક્યો ઘણાં લાંબા હોવાથી વાંચક સહેલાઈથી વાંચી શકે માટે લાંબા સળંગ વાક્યને બે કે ત્રણ વાક્યોમાં વહેંચ્યું. મરાઈમાંથી તે ગુજરાતીમાં અનુવાદીત કરવાનું હોવાથી ગુજરાતી શખદોનો જ ઉપયોગ થાય તે પણ ધ્યાનમાં રાખ્યું. વાક્ય રચના પણ સરળ થાય તેનું ધ્યાન રાખ્યું છે. તેમ છતાં મૂળ લખાણને ધ્યાનમાં રાખીને ઘણું બધું કરી શકાયું નથી. તેમ છતાં આ ગુજરાતી અનુવાદ વધુ અસરકારક બને તે ધ્યાનમાં રાખ્યું છે. આ મારું સ્વતંત્ર લખાણ નથી તે વાંચકો ધ્યાનમાં લે.

આ લખાણ પૂરુ કરવામાં સાઈકૃપા હંમેશા સર્વોપરી રહી છે. બાબાએ મારા જીવનમાં આવેલી ઘણી અદ્યારોમાંથી મને બચાવ્યો છે. બાબાના એ ઉપકારોને હું કેવી રીતે ભૂલી શકું? મારું આ નાનકડુ કાર્ય બાબાનાં ચરણોમાં અર્પણ કરેલી પુષ્પાંજલી છે. આ સાથે સાઈબાબા અંગે જેમણે જેમણે જે કાઢ લખાણ કર્યું છે તેમને મારા નમસ્કાર છે. જ્યસિંહ નિંબાળકરે ભાવપૂર્વક આ કાર્ય સોંઘ્યું તે બદલ હું તેમનો આભારી છું. તે રીતે શિરડી સાઈ ટ્રસ્ટ દ્વારા આ પ્રકાશિત થવાનું હોવાથી હું શ્રી સાઈબાબા ટ્રસ્ટના બધાજ પદાધીકારીઓને ભાવભીનાં વંદન કરું છું.

આપનો

અ. દિનેશ પાઠક

## શ્રી સાઈબાબાની ભક્તિ શા. માટે કરવી તેનાં ૧૧ કારણો

(૧) પ્રથમ અને મહત્વનું એટલે કે શ્રી સાઈસચરિત્રની રચના કરનાર શ્રી હેમાદ્રપંતના કહ્યા પ્રમાણે બાબાશ્રીના ભક્તો જે પણ માંગશે એ દરેક ઈચ્છા પૂર્ણ કરવાનું વ્રત સાઈમાઉલીએ લીધેલું છે.

જે જે માંગે સર્વ તે આપે | એ વ્રત જેમને લીધેલ છે |

માટે કહું છું કરો ગુણ ગાઈ ઉતાવળ | દર્શન તમે સાઈનું લ્યો ||૧૦ અ. ૧૩||

(૨) અને તે પણ તરત સમય ન વેડફિતાં, આપ ખરી શ્રદ્ધાથી માંગો અને સબૂરી રાખો કે કોષઠો ઉકલ્યો જ સમજો. તમે કોઈ ક્યાં પણ હો | ભાવે હાથ મુજ સામે ધરો |  
તો હું તમારા ભાવનો ભૂખ્યો | રાત દીન તમ કાવે ઊભો ||૧૭ અ. ૧૫||

(૩) પ્રસંગ પણ તેઓ કેવા સહેતાઈથી થાય છે. કઠોર તપશ્ચર્યાની કોઈ જરૂર નથી. કષ વેઢીને ઉપવાસ કરવાની જરૂર નથી કે કઠોર ઈન્દ્રિય દમનની આવશ્યકતા નથી.

મુજ સામે અનન્ય દશ્ટ રાખ | હું પણ જોઈશ તને તે રીત |

મારા ગુરુએ બીજું કંઈક | નથી શીખવ્યું મને તું જાણ |૧૭૩ અ. ૧૬||

(૪) શ્રી સાઈબાબાએ દેહત્યાગ કર્યો આજે ૨૦૦૧ની સાલ સુધી ટુ વર્ષ થયાં તો પણ એમનો ભક્તો પ્રત્યેનો પ્રેમ અને અસ્તિત્વના એંધારા આજે પણ જોવા મળે છે, અને આવનારી પેઢીએ પણ અનુભવ પામશે જ. આ એક કરુણામૂર્તિ એવી છે કે, યાદ કરતાં એને ખરા અગવડના સમયે પુકાર કરતાં, ભક્તો માટે જરા પણ વિલંબ કર્યા વગર દોડીને આવે છે અને હાજર થઈ જય છે.

ભલે ગયો હું છોડી શરીર | બોલ મારા માનો એ જ પ્રમાણ |

મારા આસ્થિ સમાધિમાંથી | આપશે તમને આધ્યાત્મન |૧૧૦૫ અ. ૨૫||

(૫) શ્રીસાઈનાથ આજે દેહધારી નથી, છતાં પણ એમની સહૃદાનું તરીકે ભક્તિ કરવાથી કોઈ પણ જાતની, છેતરામણી ભય કે ચિંતા નથી રહેતી. એ બાબતમાં કોઈ શક્યતા જ નથી. આજકાલ તો આપણા દેશમાં પોતાની જાતને ભગવાન કે અવતારી પુરુષ કે મહર્ષિ કહેવડાવનારા અનેક ગુરુઓ જોવા મળે છે. માટે ખરો સહૃદાનું કોણ એ પણ જાણવું અધરું છે.

જાતે જેણો નથી કંઈ અનુભવ્યું | એ શું શિષ્યને આપવાનો ?|

અપરોક્ષ અનુભવ ન કંઈ કેને | કદી ન કહો સહૃદાનું તેને ||૮||

લેવી શિષ્ય પાસે સેવા | ન ધરે એવો ભાવ પણ સ્વઘનમાં |

ઉલ્ટો સ્વદેહ શિષ્યાર્થે ઘસવા | ઈરછે તે જાણવો સહૃદાનું સાચો ||૧૦ અ. ૪૮||

(૬) શ્રી સાઈનાથની ભક્તિ માટે પૈસાની જરૂર નથી. ફળ, ફૂલ કે પાન પણ આદરથી અર્પણ કરીએ, તો એ પણ ખરા પ્રેમથી એટલું જ આપે છે. અરે એટલું જ નહીં પણ જે હાથ અને મસ્તક નમાવી કરેલા નમસ્કાર પણ તેઓ પ્રેમથી સ્વીકાર્ય વગર રહેતા જ નથી.

## શ્રી સાઈનું સત્ય ચિહ્ન

બે હથ ને એક માથું । સ્થૈર્ય શ્રદ્ધા અનન્યતાનું ।

શ્રી સાઈને ન જોઈએ બીજું । કૃતશતા વિષ અન્ય ન કશું ॥૧૮૦ અ. ૧૩॥

(૭) શ્રી સાઈનાથ મહારાજની બાધા (માનતા) પૂર્ણ કરવા માટે વખતે ભાડું ખર્ચને શિરડીના આંટા મારવાની જરૂર નથી, ફક્ત એમને ખરા અંત:કરણથી યાદ કરતા, ભલેને ભક્ત સાત સમુદ્રને પેલે પાર પણ ન હોય છતાં દોડી આવ્યા વગર રહેતા નથી. ફક્ત રાખવી પડે શ્રદ્ધા સાથે સભૂરી.

ન જોઈએ મને ઘોડો કે ગાડી । ન જોઈએ વિમાન કે રેલગાડી ।

હંક મારે મને જે પ્રેમથી । પ્રગઢું અવિલંબે તે જ ઘડીએ ॥૩૨ અ. ૪૦॥

(૮) એમની દ્વારકામાઈમાં (માસ્ઠિદમાં) આવેલ અખંડ ધૂણિની ભસ્મ બધા જ રોગો માટેની અક્સીર રામભાણ ઓષધી છે. જેની કિંમતા ફક્ત બે, શ્રદ્ધા અને સભૂરી જ છે.

ઉદ્દિનું આમ કરતાં અર્થન । આધિ બ્યાધિ થાય દૂર ।

પણ ઉદ્દિનો તત્ત્વાર્થ ગાહન । છે વિવેકપૂર્ણ વૈરાગ્ય ॥૧૬ અ. ૩૩॥

વળી છે આ ઉદ્દિનું વિશેષ । સેવનથી થાય પૂર્ણાયુષ ।

થશે પાપ નિવારણ અશેષ । સુખ સંતોષ સર્વદા ॥૨૩૫ અ. ૩૩॥

(૯) હેમાઉપંતે લખેલા સાઈમાઉલીના સચ્ચરિત્રમાં વેદો, ઉપનિષદ્દો અને ગીતાનો ઢગાલાબંધ સાર બોધકૃપે હેરેર આપેલ છે. એનું સતત વાંચન કરતાં કે મનન કરવાથી અને એમણે કરેલ ઉપદેશને આચરણમાં મૂકવાથી મોક્ષ પ્રાપ્તિ નિશ્ચિત છે એ અવશ્ય સમજજો.

આ ગ્રંથ નથી, પણ છે કલ્પવૃક્ષ । સંસારીને લાગે રૂક્ષ ।

મુમુક્ષો માટે કેવળ મોક્ષ । અનુભવ એનો કરવો પ્રત્યક્ષ ॥૧૭૧ અ. ૫૩॥

(૧૦) સાઈસમર્થનું ‘સાઈ’એ નામ આમ તો ફક્ત બે અક્ષરનું જ છે. પણ ઉચ્ચારણ કરવામાં મધુર અને સહેલું કેટલું છે ? કોઈ અધરા જ્ઞેડાક્ષરો પણ નથી. એમનું સ્મરણ કરતાં જ્ઞાને કોઈ પણ જ્ઞાનનું કષ પડતું નથી.

હોડો લાખો ચતુરાઈ । સ્મરો નિરંતર સાઈ સાઈ ।

થશે નક્કી બેડો પાર । સદેહ ન રાખવો લગારે ॥૧૩૫ અ. ૧૦॥

(૧૧) છેલ્લું અને અતિ મહત્વનું કારણ એટલે કે શ્રી સાઈબાબા આપની દરેક ધર્યાઓ પૂર્ણ કરતા હોય છે, પણ એની સાથે સાથે તેઓ તમને આ મોહમ્ય સંસારમાં અટવાવા દેતા નથી. ઉલ્લંઘની ધર્યાએ તમને વાંચવાર પરમાર્થની મીઠાશ તરફ વાળીને દિશાઓ બતાવી આનંદમય મોક્ષ તરફ દોરી જય છે. આવા આપણા ભોલાબાબા સાઈશંકરને વારંવાર પ્રણામ છે.

થઈ મને અનન્ય શાણ । જેને માડું અખંડ શરણ ।

તેનું મહારા પરનું ઋણ । કુંઠું તેનો કરી ઉદ્ધાર ॥૧૫૧ અ. ૪૪॥



## સાઈ સરચ્ચરિત્ર કેવી રીતે વાંચવું

એક ભક્તે મને પત્ર લખીને જાળાવ્યું હતું કે, શ્રી સાઈસરચ્ચરિત્રના લગભગ ૧૦ થી ૧૨ વર્ષથત પારાયણ કરવા છીતાં પણ એમને ધારેલું ફળ મળ્યું નથી. બીજન એક ભક્તને આ ચરિત્ર કેવી રીતે વાંચે છે એ મને વાંચીને બતાવ એમ જણાવતા, એમણે ઓવીઓ ઝડપથી ચાલતી રેલગાડીની માફક ફટફટ વાંચવાની શરૂઆત કરી. મોટા ભાગે ઘણા જ સાઈભક્તો શ્રી સાઈસરચ્ચરિત્ર, અથવા તો કોઈપણ પોથી આવી ઉતાવળે જ વાંચા હોય છે. પણ આ ખરી રીત નથી. આમ ઉતાવળ કરીને અર્થ તરફ ધ્યાન ન આપતાં વાંચવાથી એનો ઉદ્દેશ કર્યારે પણ સફળ થતો નથી. અક્ષરો ઓળખીને વાંચતા ફાલે બસ એટલું જ ! અત્ત્રને જેટલું ચાવીએ એટલું પાચન સારું થાય છે, અને જેટલું સારું પાચન થાય એટલું શરીરમાં એનું લોહીમાં ઝૂપાંતર થાય છે. એ બીલકુલ જ સાચું છે. એક પણ ઓવી જો અર્થ સમજીને સારી રીતે જીવનનાં સાકાર કરી ઉતારવામાં આવે તો જીવન ઉજ્જવળ બની ઉઠી છે. માટે જ નામદેવ મહારાજ જાનેશ્વરીમાં લખે છે કે -

સંત શ્રેષ્ઠ જ્ઞાનની દેવી । એક પણ ઓવી અનુભવવી ।

(ઓવી અનુભવવી, ફક્ત વાંચી જવી નહીં.)

અને હેમાઉપંત કહે છે કે -

પ્રેમ વિનાનું ભજન કેવું ? અને અર્થ વગરની પોથી વાંચવી તે કેવી ? ॥૨૦૪ અ. ૧૪॥

એકલા વાંચને કામ ના સરે । ઉતારવું કૃતિમાં જોઈએ ।  
રેઝચું પાણી આ તો ઉધી ગાગરે । આ તો સર્વ તેવું થયું છે ॥૭૨॥

॥અ. ૨૧॥

શ્રી સાઈસરચ્ચરિત્ર અથવા તો બીજી કોઈ પણ પોથી, કોઈ પણ જાતની ઉતાવળ ન કરતાં ધીરિધીરે અર્થ સમજીને જ વાંચવી જોઈએ. એ બાબતમાં સાઈસમર્થે પોતે પણ આપેતી શિખામણ શ્રી સાઈસરચ્ચરિત્રમાં ત્રણ ઠેકાણો જોવા મળે છે.

(૧) પ્રથમ તો અધ્યાય ૧૮માં સાહે દ્વારા ગુરુચરિત્રનું સપ્તાહ પૂર્ણ કર્યું તે રાતના શ્રીસાઈનાથ મહારાજે એમને જાણે કે દદાંત આપીને પોથી કેવી રીતે વાંચવી એ જ બતાવ્યું છે.

પૂર્ણ સપ્તાહ થતાં રાત્રે । બાબા દદાંત તેમને હૈ ।  
લઈ પોથી પોતે સ્વહસ્તે । સાહેને અર્થ સમજવે ॥૪૪॥

પોતે બેસી નિજ આસને । સાહેને બેસાડી સાથે ।  
ગુરુ ચરિત્રની લઈ પોથી । થયા તત્પર નિર્દ્દિપણે ॥૪૫॥

॥અ. ૧૮॥

(૨) ત્યારબાદ અધ્યાય ૪૧માં દહાણુના બાળાસાહેબ દેવના સ્વર્ણમાં જઈને બાબાએ તેમને પૂછ્યું જાનેશ્વરી સમજય છે કે ? અને પછી કેવું રીતે વાંચન કરવું તે પણ સમજાવ્યું હતું -

બાબા કહે તમો વાંચતા પોથી । કરો છો બહુ ઉતાવળ વળી ।  
વાંચો પોથી મુજ સમક્ષ । લગાવી આસન પ્રત્યક્ષ ॥૧૬૪ અ. ૪૧॥

## શ્રી સાઈનું સત્ય ચિત્ત

(૩) એવી જ રીતે પોથી વાંચીને એનો સાર પોતાના આચરણમાં લાવવો જ જોઈએ. આ બાબતનો ઉલ્લેખ અ. ૨૧માં બેળગાંધ પાસે વડગાંધ મુકામે એક સતપુરુષનાં દર્શન કરીને શિરડી આવેલા શ્રી વિનાયક ઠાકુરથી કથામાં જેવા મળે છે.

કહે છે તેને સાઈનાથ । યથાર્થ આખ્યાનું કહેવું છે ।  
પણ જ્યારે કૃતિમાં તે ઉતરે । ત્યારે મનોરથ થાયે પૂર્ણ ॥૧૬॥

॥અ. ૨૧॥

બીજુ મહત્વની વાત એ જ કે જે પોથી સમજને વાંચવી હોય તો, મનની એકાશતા અને સ્વસ્થતા તો હોવી જ જોઈએ -

અથવા તો તે વાંચન નથી । જ્યાં સાનર કાન શ્રવણે નથી ।  
એકતાન વૃત્તિ જ્યાં નથી । શાષ્ટ્રાર્થ કોણ ત્યાં સમજ શકે ॥૧૪॥

॥અ. ૫૦॥

ફોગટ ગયું ગ્રંથાવલોકન । વ્યર્થ નીવડચું શાસ્ત્ર પરિશીલન ।  
વ્યર્થ સકળ આ પુસ્તકીયું જ્ઞાન । અસ્વસ્થ મન જે જ્યાં લગી ॥૮૧॥

॥અ. ૨૧॥

આ બધામાં સૌથી મહત્વનું છે, તે એ કે પોથી વાંચનમાં જે શ્રદ્ધા અને સબૂરીની ઓટ હોય તો ઘારેલું ફળ કરાપિ મળતું નથી -

સબૂરી અને શ્રદ્ધા યુક્ત । સાદર સેવતાં કથામૃત ।  
લાલે ભક્તિ પ્રેમથી યુક્ત । થશે સર્વજન કૃતકૃત્ય ॥૮॥

॥અ. ૧૫॥

છેલ્લે સંત શ્રેષ્ઠ શ્રી જ્ઞાનેશ્વર મહારાજે એક અતિ સુંદર ઉપમા આપીને પોથી કેવી રીતે વાંચવી જોઈએ એ કહ્યું છે, તે ભક્તોએ મનનમાં સજજા બેસાડી દેવું જોઈએ.

‘ચકોર પક્ષીના બચ્ચાં શરદ ઋતુનાં ચંદ્ર કિરણોમાંથી અમૃતકણોને જે રીતે પ્રેમથી ધીમે ધીમે વહેંચી લે છે. એ પ્રમાણે શોતાઓએ કથા ચિત્ત એકાગ્ર કરી ધીમે ધીમે એનો આસ્વાદ અને અનુભવ લેવો.’

જ્ઞાનેશ્વરી અ. ૧



## શ્રી સાઈસચ્ચરિત્ર વાંચવાની ફળકૃતિ

શ્રી સાઈસચ્ચરિત્ર વાંચનનું માહાત્મ્ય અને ફળદાયક ઓવીઓ ગ્રંથના અધ્યાયોમાં ધારી બધી જગ્યાએ વપરાઇ છે. ગાણવા જઈએ તો એની સંખ્યા એકસો પંચોતેરથી પણ વધારે થાય છે. એમાંની બાબાશ્રીની પોતાની સુંદર ઓવીઓ અને અવતરણકાના લેખક ‘બાબાનું બાળક’ અને હેમાડપંતના શબ્દો એમ બધી મળીને પડ ઓવીઓ નીચે આપેલ છે. એમાંથી ખૂબ જ મહત્વની ૧૧ ઓવીઓ ગાઢ કાળારંગમાં ઉપસી આવે એ રીતે છાપવામાં આવી છે.

ખુદ સાઈનાથ મહારાજે કહ્યું છે -

કરતાં ભારી કથાનું શ્રવણ | તેનું કીર્તન ને ચિંતન |  
 થરો મહાભક્તિનું જગતન | અવિદ્યા નિવારણ રોકડું ||૮૨||                  અધ્યાય-૨  
 ત્યારે જો ગાયે લાડકોડથી | ચરિત્ર સ્તુતિ ભારા પ્રેમથી |  
 આગળ પાછળ હું તેની | ચારે બાજુએ ઊભો જ છું ||૯૨||  
 કોઈ પણ કીર્તન માસું કરશે | આપીશ આનંદ ધન તેને |  
 નિત્ય સૌખ્ય સમાધાન તેને | આ વચન સત્ય માનજો ||૯૪||  
 થમરાજના જડબામાંથી | ભારા ભક્તને કાઢીશ ખેંચી |  
 કેવળ મતકથા શ્રવણથી | રોગ નિરસન જડર થશે ||૯૭||  
 કરો કથા સાદ્ર શ્રવણ | પછી કરો તેનું પૂર્ણ મનન |  
 મનન પછી નિહિદ્યાસન | કરતાં સમાધાન પામશો ||૯૮||                  અધ્યાય-૩

સચ્ચરિત્ર - કવિ હેમાડપંત કહે છે કે -

યોગ, યાગ, ધ્યાન, ધારણા | કરવા પડે પ્રયાસ દાણા |  
 એવું કષ્ટ નથી કથા શ્રવણમાં | કેવળ ધ્યાન રાખવું પડે ||૫૭||  
 એવી સાઈની કથા નિર્મળ | સાંભળો સજજન શ્રોતા પ્રેમાળ |  
 બળશો પંચ મહાપાપ પ્રબળ | પામશો સમૂળ વિનાશ તે ||૫૮||  
 થતા ગર્ક સંસારમાં | સંતકથા જો પડે કાનમાં |  
 વિષ જરાયે પ્રયત્ન કરતાં | કલ્યાણ કરે છે આપોંઆપ ||૫૯||  
 તો ભક્તિભાવે તે સાંભળતા | કેટલું શૈય આવે હથમાં |  
 શ્રોતાએ કરવો વિચાર ચિત્તામાં | તેનો સ્વહિત કારણે ||૬૦||  
 ન જોઈએ વ્રત ઉધાપન | ન જોઈએ અપવાસ શરીર શોષણ |  
 ન જોઈએ તીર્થયાત્રા પર્યટન | સરે કાર્ય એક શ્રવણથી જ ||૬૧||                  અધ્યાય-૩

## શ્રી સાઈનું સત્ય ચારિત્ર

થઈને શ્રદ્ધાભક્તિ યુક્ત | કરે જે પારાયણ નિત્ય |  
આ અધ્યાયનું થઈ સ્વસ્થચિત | આપહાનિર્મુક્ત | ૧૫૦||

પૂર્ણ થશો અપૂર્વ ઈચ્છિત કામ | થશો અંતે પૂર્ણ નિજકામ |  
પામશો દુર્લભ સાયુજ્ય ધામ | અખંડ રામ પામશો | ૧૫૨||

પુણ્યવાન આ ચરિત્ર | જેવું જળ ગંગાનું પવિત્ર |  
ધન્ય શ્રવણ કરનારના શ્રોત | આલોક-પરલોક સાધનાર | ૨૧||

અમૃતની ઉપમા દઈએ એને | તો અમૃત એથી કંઈ મીઠું છે ?|  
અમૃત પ્રાણરક્ષણ કરે | પણ જન્મ નિવારક ચરિત્ર આ | ૨૨||

આ કથા નિત્ય કાને પડે | દીસે સાઈ નિત્ય નયને |  
રાત્રિન મને ધ્યાને | રહે સમરણે ચિંતને | ૩૨||

લાગે દીસવા જગૃતિ સ્વાને | સૂતાં બેસતાં આહાર કાળે |  
સાથે જતાં આવતાં આવે | નિર્જન વને કે શહેરે | ૩૩||

એમ આવતાં નિદિધ્યાસને | મન તો દશા ઉનમની પામે |  
નિત્ય એમ થવા લાગે | સમરસ ચિત્ત ચૈતન્યે બને | ૩૪||

ન ચરિત્ર પણ લંડાર સુખનો | મીઠાઈ મેવો નિજ પરમામૃતનો |  
ભાસ્યવાને એ સેવવો | ભક્તિભાવથી હુંમેશા | ૨૧૫||

ગુરુમુખથી મધુર કથા | સુણતા જશો ભવભવ્ય કથા |  
શેલરશો આનંદ શ્રોતાચિત્તમાં | નિજતમતા સ્વયં પ્રગટશે | ૧૦||

આ અધ્યાય આદરે વાંચે | વા નિયમે આવતન તેનું કરે |  
સંકટ ગુરુરાય તેનાં હરે | અંતરે વાત આ સંચરો | ૧૦૫||

ચરિત્ર શ્રવણે પાતક નાશ | ચરિત્ર શ્રવણે કાળને ફાંસ |  
ચરિત્ર શ્રવણે પરમ ઉલ્લાસ | શ્રોતા થાય કામના રહિત | ૧૦૮||

સુષુપ્ત યા બુદ્ધિહીન | વાંચતા પ્રગટે પરમાનંદ |  
સાંભળતાં વધે શ્રવણ છંદ | મનને સ્વાનંદ સંતુષ્ટ | ૧૫૮||

પારાયણે પરમાર્થ બોધ | નિદિધ્યાસને મહદુદ્દ આલહાદ |  
સૌખ્ય ઉપને અખંડ નિર્વાધ | એવી અગાધ આ લીલા | ૧૦૬||

ઉગતાં જેમ દિનમણી | અંધકાર જય નહાસી |  
તેમ આ કથા અમૃતપાનથી | થઈ જય છે માયા લોપ | ૧૩૪||

આ સરચારિત્ર માર્ગ સરળ | જયાં જયાં થાય એનો પાઠ |  
ત્યાં જ ક્રારકામાદીનો મઠ | પ્રગટે ત્યાં સાઈ પણ નિશ્ચયે | ૨૧૮||

અધ્યાય-૧૧

અધ્યાય-૧૨

અધ્યાય-૧૪

અધ્યાય-૧૫

અધ્યાય-૧૭

અધ્યાય-૨૦

શ્રી સાઈનું સત્ય ચરિત્ર

ત્યાં જ જાણો ગોદાવરીતટ | ત્યાં જ શિરકી ક્ષેત્ર નજીક |  
 છે ત્યાં જ સાઈ ઘૂણી સહિત | સમરતાં સંકટ નિવારે ||૨૧૬||

જ્યાં સાઈચરિત્ર પઠણ | ત્યાં સેંટેવ સાઈ રહેઠાણ |  
 શ્રીજ્ઞાપૂર્વક ચરિત્રપારાચાણ | કરતાં પ્રસન્ન તે સર્વ ભાવે ||૨૨૦||      અધ્યાય-૩૫

દિવસના કોઈ પણ પ્રહરે | ચરિત્ર આ નિત્ય વાંચે |  
 ભેટે નિર્ધાર એ ભાવિકને | નિજગુરુ સહ શ્રી હરિ ||૮૯||

જે નિરંતર એ વાંચે | લક્ષ્મી નાણે તેને ઘરે |  
 નિદાન સપ્તાહ એક જો કરે | તો દરિક્ર દૂર તેનું થાય ||૮૭||      અધ્યાય-૩૭

કરીને અકાશ મન | અભિવંન સાઈચરણ |  
 મહામંગલ પરમ પાવન | આ કથાનું જે કરે શ્રવણ ||૧૩||

જે ભક્ત ભક્તિ સહિત | નિજસ્વાર્થ સાધવા તત્પર |  
 તે થઈને એકાશચિત્ત | આ કથામૃત સેવશે ||૧૪||

સાઈ પૂરાં કરે તેનાં કાર્ય | પૂર્ણ કરશે સ્વાર્થ ને પરમાર્થ |  
 ન જાય સેવા કદી બ્રથ | અંતે તે કરશે કૃતાર્થ ||૧૫||      અધ્યાય-૪૫

શ્રવણ કરતાં સાઈચરિત્ર | શ્રોતા વક્તા નિત્ય પવિત્ર |  
 થાય પાપ પુણ્યનો નાશ | નિત્ય મુક્ત છે બેઉ ||૧૬||

સુણતાં શ્રોત્રનાં ભૂટાં ભાગ્ય | વક્તાના વક્ત્રનાં મોટાં ભાગ્ય |  
 આ શ્રી સાઈસ્તોત્ર ધન્ય | અતિ પવિત્ર નિજભક્તને ||૧૭||      અધ્યાય-૪૮

તોડવા સંસાર બંધન | એથી નથી અન્ય સાધન |  
 સાઈકથા પરમપાવન | સદા સેવન સુખદાઈ ||૨૫||      અધ્યાય-૪૯

હૃપે થાય છે એવું મને | બાબાના ચરણ પકડીને |  
 એક પ્રાર્થના કરું તેમને | સકલ ભક્તજન હિતાર્થ ||૪૨||

કે આ ગ્રંથ સર્વને ઘેર | રહે થાય નિત્ય પાઠાંતર |  
 કરે નિત્ય જે પ્રેમે પારાચાણ | હણજો સંકટ તેમનાં ||૪૩||

થઈને શુચિર્ભૂત | પ્રેમ અને શ્રીજાયુક્ત |  
 વાંચે જે સાત દિવસમાં | અનિષ્ટ શાંત તેમના ||૪૪||

કરતા આ સચ્ચચરિત્ર શ્રવણ | અથવા નિયમે પારાચાણ |  
 કરશે સાઈસમર્થ ચરણ | સંકટ નિવારણ વિદંબ વિના ||૪૫||

ધનેચ્છને લાભશે ધન | શુદ્ધ વ્યવહારે યશ પૂર્ણ |  
 મળશે ફળ નિષ્ઠા સમાન | ન આવે અનુભવ ભાવ વિના ||૪૬||

## શ્રી સાઈનું સત્ય ચિત્ર

આદ્દરે કરતાં ગ્રંથ વાંચન | સાઈસમર્થ સુપ્રેસન્ન |  
 કરે અજ્ઞાન દારક્રિય વિચ્છિન્ન | આપે જ્ઞાન ધનસંપન્તતા ||૪૮||  
 કરીને ચિત્ત સુસમાહિત | નિયમનિષ્ઠ આ સર્વચિત |  
 વાંચવો એક તો અદ્યાય નિત્ય | થશે તે અમાપ સુખદાયી ||૫૧||  
 જેને મને સ્વહિત વિચાર | વાંચવો આ ગ્રંથ તેણે સાચાર |  
 જન્મોજન્મ સાઈના ઉપકાર | યાદ આવશે સાનંદ ||૫૨||  
 ગુરુપૂર્ણિમા ગોકુળ અષ્ટમી | પુણ્યતિથિ રામનવમી |  
 એ સાઈના ઉત્સવે નિયમથી | ગ્રંથ નિજગૃહે વાંચવો ||૫૩||  
 આવા ગ્રંથ અભ્યાસે સંપૂર્ણ | મનોકામના થશે પૂર્ણ |  
 હદ્દે રાખવાથી સદ્ગુરુ ચરણ | થશો ભવસાગર ઉત્તિર્ણ ||૮૩||  
 રોગી બને આરોગ્યવાન | દરિદ્ર થાય ધનાઢ્ય |  
 સંકલ્પ વિકલ્પ મેળવે સ્થૈર્ય | દીન મેળવશે ઔદ્ધાર્ય ||૮૪||  
 પિશાચ બાધા અપસ્માર | ગ્રંથાવર્તને થશે દૂર |  
 મૂક અપંગ પંગ બધિર | તેમને પણ શ્રવણ આ સુખકર ||૮૫||  
 જે શક્તિમાન પરમેશ્વર | ભૂલી ગયા તેમને જે નર |  
 એવા જે અવિદ્યા મોહિત | થશે ઉદ્ધાર તેમનો ||૮૬||  
 નર હોઈ કરે અસુર આચાર | એ રીતે મિથ્યા ગુમાવે શરીર |  
 માને સંસાર સુખની ખાણ | થશો ઉદ્ધાર તેમનો પણ ||૮૭||  
 અવતરણિકા રચયિતા ‘બાબાનો બાળ’ કહે છે-  
 ગ્રંથ નહીં એ કલ્પવૃક્ષ | સંસારી જનને લાગે રુક્ષ |  
 મુમુક્ષુ ભાવિકનો કેવળ મોક્ષ | લેવો અનુભવ પ્રત્યક્ષ ||૧૭૧||  
 ચોખ્યુ રાખી અંત:કરણ | ભક્તિભાવે કરવું પારાયણ |  
 એક, બે કે ત્રણ દિવસે કરવું તેને પૂર્ણ | સાઈનારાયણ થશે પ્રસન્ન ||૧૮૨||  
 અથવા કરો સરસ સાત હિન સખ્તાહ | થશે પુણ્ય સંપત્તિ ગ્રાન્ત |  
 પૂર્ણ કરશે સાઈ મનના કોડ | ભવલ્ય ભન થઈ જશો ||૧૮૩||  
 થશે તુષ્ટ આપી સાઈ ભગવાન | દેશે ભક્તને વરદાન |  
 છેદશે ભવભયનો સર્પ | મોક્ષલંડાર દેખાડશે ||૧૮૪||

અધ્યાય-૫૨



